

19.05.2024

To BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001. Scrip code : 509152	To National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051. Symbol : GRPLTD – Series: EQ
---	--

Dear Sir / Madam,

Sub: Compliance under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Company has published audited standalone and consolidated financial results of the Company for the 4th quarter and financial year ended 31st March, 2024 on 19th May, 2024, in English newspaper - Financial Express (all editions) and in Gujarati newspaper- Gujratmitra.

Newspaper clippings for the same are being submitted for your records.

Thanking you,

For GRP Limited



Jyoti Sancheti

Company Secretary & Compliance Officer



encl: a/a

GRP Ltd.

CIN No.: L25191GJ1974PLC002555

Registered Office:

Plot No. 8, G.I.D.C., Ankleshwar - 393 002, Dist. Bharuch, Gujarat, India

T: +91 2646 250471 / 251204 / 650433

www.grpweb.com

FROM THE FRONT PAGE

Cool destinations...

"Superluxury properties and homestay owners will go to destinations where the world is going. This campaign will create a demand for infra and make India a 365-day destination for both homestays and luxury travellers," she said. A transformation is already underway. Mizoram has an AQI between 25 and 39 and an average tourist footfall of over 161,000 pre-Covid. Former CM Zoramthanga had invited tourists a few years back to come and "breathe the clean air" when Delhi and other cities were grappling with air pollution. The Gulmarg gondola cable car ride, for the first time, saw over a million tourists in FY 2023-24. As per J&K tourism department, it saw an unprecedented revenue growth, crossing over ₹110 cr, surpassing all previous figures.

While India's tourism landscape evolves, with infra expansion, hotel development, a burgeoning middle class, and accelerated growth of air travel, Jyoti Mayal, president, Travel Agents' Association of India (TAAI), said: "This initiative draws attention to lesser known destinations and alleviates overcrowding at popular tourist spots. The campaign is poised to attract international visitors and will drive tourism growth." India saw a 64% surge in foreign tourist arrivals in 2023, with 92,36,108 visitors between January and December 2023, compared with 64,37,467 in the same period of the previous year, as per ministry of tourism data.

Cooler climes are a natural choice in summer. But popular

places like Shimla are more urban sprawls of haphazard construction, water shortage, overtourism and choked roads in peak tourist season. "This time, Ooty tops our list of the most searched summer destinations with a 20% hike in searches compared to the same time last year. Indians are escaping to the hills, with Manali, Munnar, Kodaikanal, Darjeeling, Kodaikanal, Rishikesh, Srinagar and Lonavala among the top searched domestic destinations," said Santosh Kumar, country manager for India, Sri Lanka, Maldives and Indonesia, Booking.com. The portal's Travel Predictions 2024 suggests 76% of Indian travellers are headed to cool places this summer.

For MakeMyTrip, summer is one of the biggest quarters of the year in terms of travel intent. Rajesh Magow, co-founder and Group CEO, MakeMyTrip, said, "This year the buoyancy in the sector continues. We are observing a healthy growth in searches over those recorded last year."

Kashmir, Ladakh and Himachal Pradesh continue to reign. Rajiv Mehra, president, Indian Association of Tour Operators (IATO), and general secretary, Federation of Associations in Indian Tourism and Hospitality (FAITH), said: "Hotel rates are affordable in the summer so this is one big draw. The association and its members are doing our best to draw tourists from abroad. With initiatives like 'Chalo India' and government support, we can do things at a much larger level." However, accessibility to most hill places remains a challenge. While most destinations have an excellent road network, rail and air travel for the targeted premium visitor is a major concern. Most places

do not have direct access to flights or even heliports.

MGNREGS...

Officials said that in many states where labour is expensive, a new trend has emerged — that of getting MGNREGS work done through machines and paying a share of the money to workers who lend their identity to be used in the scheme. "Such practices make the scheme look like its purpose is only distribution of the budget allocation instead of making the scheme a demand-driven work for unemployed people," officials said. The Centre would have to take some corrective measures to clamp down on such misuse by the better-off states compared with low-income states like Bihar, officials added.

OYO...

The move brought down its outstanding loan amount to around \$450 million. A source told PTI, "The refinancing will result in material changes to OYO's financial statements. Hence as per existing regulations, it will need to revise its filings with the regulator."

"Since the decision for refinancing is at an advanced stage, it doesn't make sense to continue pursuing IPO approval with the current financials. So it's prudent to withdraw the current application," he added.

The refinancing will extend the repayment timeline to 5 years, however the repayment of the remaining TLB due in 2026, the source said. The bond issuance would significantly lower the current effective interest rate of 14% on its existing \$450 million term loan B (TLB) facility. "The refinancing is expected to result in annual

interest savings of \$8-10 million (₹66.4 crore - ₹83 crore) in the first year, after accounting for the costs associated with the bond issuance. The company anticipates annual savings of \$15-17 million (₹124.5 crore - ₹41.1 crore) thereafter, almost all of which would get added to its net profits. Post the debt refinancing, the firm is open to contemplating an equity round to reaffirm investor confidence before a public listing to fortify its financial strength," the source said. In Sept 2021, OYO had filed preliminary documents with Sebi for a ₹8,430-crore IPO. It was delayed due to then volatile market conditions, making the firm prepare to settle for a lower valuation at around \$4-6 billion instead of the \$11 billion it was targeting initially.

N Vaghul...

Above all, Vaghul will always be respected and admired for his integrity. In times when other bankers were known to succumb to pressure from New Delhi, he was able to fight it; it was these values and principles that set him apart from his peers. There are several anecdotes in his book *Reflections* released last year that give us an insight into how bankers were put in difficult situations by politicians and bureaucrats who expected the former to toe their line. Vaghul, too, found himself in such predicaments, but to his immense credit, he managed to stand his ground, sometimes even threatening to resign. It could not have been easy but then Vaghul was never one to compromise on his values.

ADDRESS GLOBAL CHALLENGES

India, UK review progress made on 'Roadmap 2030'

Countries reaffirm commitment to free trade agreement

PRESS TRUST OF INDIA New Delhi, May 18

A COMPREHENSIVE REVIEW of the India-UK 'Roadmap 2030' was undertaken during foreign secretary Vinay Kwatra's two-day visit to London, the Ministry of External Affairs (MEA) said on Saturday. This includes a reaffirmation of both countries' commitment to conclude a mutually beneficial free trade



UK's permanent under-secretary Philip Barton with India's foreign secretary Vinay Kwatra

agreement (FTA). The two sides also agreed to further strengthen bilateral cooperation in areas of trade, defence and security, science and technology and people-to-people exchanges.

The foreign secretary visited the UK from May 16 to 17 to attend the 16th round of Foreign Office Consultations (FOC) between the two sides. In 2021, India and the UK adopted a 10-year roadmap to expand ties in the key areas of trade and economy, defence and security, climate change and people-to-people connections among others.

Tributes pour in for banker N Vaghul

SACHIN KUMAR Mumbai, May 18

SADDENED BY THE passing of veteran banker Narayanan Vaghul, corporate India and policymakers poured in their tributes and hailed his contributions in modern banking sector of the country.

After starting his career as an officer with the State Bank of India, he became the youngest chairman of public sector lender Bank of India at 44 in 1981. The dynamic banker is credited with transforming Industrial Credit and Investment Corporation of India (ICICI) from a public

NIRMALA SITHARAMAN, FM N Vaghul, an eminent banker, team builder, mentor for many in the financial world and an exemplary leader of the banking sector is no more"

SHAKTIKANTA DAS, RBI GUV A visionary. Made huge contribution to India's financial sector. Every interaction with him was refreshing"

financial institution to a private bank. After stepping down as Managing Director & Chief Executive Officer in 1996, Vaghul presided over the board as non-executive chairman till 2009 and groomed K V Kamath as the next CEO. "From the day he stepped down from his executive role he did not involve himself in any day-to-day matters. He was always supportive and encouraging of all the bold moves that we

forayed to execute be it our way into retail, the setting up of new businesses such as asset management, insurance and the merger of the parent and the bank," Kamath told FE. "He was always there for all of us at ICICI as a leader, a friend, philosopher and guide," he added. During his decades-long professional journey, he groomed many talents who later headed banks and financial institutions. The long list of his proteges includes

Chanda Kochhar, former MD & CEO, ICICI Bank; Shikha Sharma, former MD & CEO of Axis Bank; Kalpana Morparia, chairperson of JP Morgan South and Southeast Asia; Sandeep Bakshi, MD & CEO, ICICI Bank; Renuka Ramnath, MD & CEO of private equity firm Multiples Alternate Asset Management; and V Vaidyanathan, MD & CEO, IDFC First Bank. Recognising his immense contribution to the financial sector, the government conferred him Padma Bhushan in 2010 in the Trade and Industry category. His leadership imprint extended beyond the financial realm. He also served as a mentor to numerous leaders, including Anand Mahindra and Kiran Mazumdar-Shaw among others. "Today, I grieve for the Bhisma Pitamah of Indian Banking — N Vaghul, who passed away this morning," wrote Anand Mahindra on X.

"I grieve not just for a Titan of Indian Business, but for one of the most inspiring & generous people I have ever had the good fortune to encounter," he added. "My greatest mentor breathed his last. I was blessed to know him as my mentor and friend. RIP Mr Vaghul — your legend lives on for posterity," said Kiran Mazumdar-Shaw, executive chairperson of Biocon.

Heatwave in NW India for 5 more days

THE EXTREME HEAT crippling large parts of northwest India will continue for another five days, with Delhi, Haryana, Punjab, Rajasthan and Uttar Pradesh predicted to bear the maximum impact. Swathes of north India stewed in brutal heat on Friday, with maximum temperatures soaring to a scorching 47.4 degrees Celsius in west Delhi's Najafgarh, the highest this season in the country so far.

The IMD on Saturday predicted severe heat wave over the plains of northwest India over the next five days and heat wave over east and central regions during the next three days. The Met office also issued a red warning for Delhi, Haryana, Punjab and west Rajasthan.

BROOKS LABORATORIES LIMITED
 CIN No.: L24232HP2002PLC000267, Regd Office: Village Kishanpura, Nalagarh Road, Baddi, Dist. Solan H.P.-174101, E-mail: investors@brookslabs.net | Website: www.brookslabs.net

EXTRACTS OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024 (₹ in Lakhs)

Sr. No.	Particulars	Standalone				Consolidated					
		Quarter Ended		Year ended		Quarter Ended		Year ended			
		31-Mar-24	31-Dec-23	31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Mar-23		
1	Total income from operations (net)	1,837.53	2,190.16	1,264.13	8,044.16	5,565.33	1,837.53	2,190.16	1,264.13	8,044.16	6,341.61
2	Net Profit / (Loss) for the period from ordinary activities (Before Share of Profit / (Loss) of Associate, tax, Exceptional and/or Extraordinary items)	30.34	60.35	(71.19)	155.46	(818.31)	30.34	60.35	(71.19)	155.46	(3,541.68)
3	Net Profit / (Loss) for the period before tax (after Share of Profit / (Loss) of Associate, Exceptional and/or Extraordinary items)	30.34	60.35	(71.19)	155.46	(818.31)	(960.60)	(385.27)	(429.04)	(1,956.60)	(3,837.00)
4	Net Profit / (Loss) for the period after tax (after Share of Profit / (Loss) of Associate, Exceptional and/or Extraordinary items)	30.34	57.76	(71.19)	152.87	(818.31)	(960.60)	(387.86)	(429.04)	(1,959.19)	(3,104.60)
5	Total Comprehensive Income for the period (comprising profit or (loss) for the period (after tax) and other Comprehensive income (after tax))	26.01	57.76	(75.29)	148.54	(822.41)	(964.93)	(387.86)	(433.14)	(1,963.52)	(3,108.70)
6	Equity Share Capital (Face Value ₹10/- per share)	2,624.67	2,624.67	2,470.28	2,624.67	2,470.28	2,624.67	2,624.67	2,470.28	2,624.67	2,470.28
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year.	3,207.61	3,207.61	4,030.03	3,207.61	4,030.03	4,925.05	4,925.05	6,278.72	4,925.05	6,278.72
8	Earnings per share (of ₹10/- each) (not annualised)										
(a)	Basic	0.10	0.23	(0.29)	0.58	(3.32)	(3.77)	(1.51)	(1.74)	(7.67)	(12.57)
(b)	Diluted	0.10	0.23	(0.29)	0.58	(3.32)	(3.77)	(1.51)	(1.74)	(7.67)	(12.57)

Notes: The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the quarter and year ended 31st March, 2024 filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Standalone and Consolidated Financial Result for the quarter and year ended 31st March, 2024 is available on www.bseindia.com, www.nseindia.com and www.brookslabs.net.

Place: Baddi
Date: 18th May 2024

DATA PATTERNS
DATA PATTERNS (INDIA) LIMITED
 (Formerly known as Indus Teqsite Private Limited)
 Registered Office: Plot No. H9, Fourth Main Road, Sipcot It Park, Siruseri, Off Rajiv Gandhi Salai (OMR), Chennai- 603 103; CIN: L72200TN1998PLC061236
 Website: www.datapatternsindia.com; e-mail: investorgrievance@datapatterns.co.in; Phone: +91-44-47414000

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31 MARCH 2024 (Rs in Crores except EPS)

Sl. No.	Particulars	Quarter ended	Year ended	Quarter ended
		(Audited)	(Audited)	(Audited)
		March 31, 2024	March 31, 2024	March 31, 2023
1.	Total Income from operations	194.57	565.83	188.91
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	95.32	242.19	72.14
3.	Net Profit / (Loss) for the period (before Tax, after Exceptional and/or Extraordinary Items)	95.32	242.19	72.14
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	71.10	181.69	55.36
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	70.28	181.06	54.46
6.	Paid up equity share capital (Face value of Rs 2 each)	11.20	11.20	11.20
7.	Reserves (Excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the Previous Year	1,313.01	1,313.01	1,155.88
8.	Earnings per equity share (EPS) of face value of Rs 2 each* (for continuing and discontinued Operations) (Basic and Diluted)	12.70	32.45	10.49

*EPS is not annualised for the quarter ended 31st March 2024 and 31st March 2023.

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly and year ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly and year ended Financial Results are available on the websites of Stock Exchanges, i.e., BSE Limited ('BSE') at www.bseindia.com and National Stock Exchange of India Limited ('NSE') at www.nseindia.com and the Company at https://www.datapatternsindia.com.
 2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on May 18, 2024.
 3. Final dividend of INR 6.50 per share is proposed and the proposed dividend is subject to approval of shareholders in the ensuing Annual General Meeting.

For and on behalf of the Board
DATA PATTERNS (INDIA) LIMITED
 Srinivasagopalan Rangarajan
 Chairman and Managing Director
 DIN : 00643456

Place: Chennai
Date: May 18, 2024

Punjab & Sind Bank
 (A Government of India Undertaking)
 H.O. Accounts & Audit Department, Corporate Office, NBCC, 1st Floor, Block No. 3, Patis 8, Office Block, East Kirti Nagar, New Delhi - 110023
 Where service is a way of life

TENDER NOTICE
 Sealed tenders are invited for Selection of Vendor for Supply, Deployment, Maintenance and Support of Centralised Web Based e-TDS system in the Bank. Request for Proposal (RFP) may be downloaded from Bank's website https://punjabandsindbank.co.in/. Last date and time for bid submission: 10.06.2024 by 04:00 p.m. Any further changes related to the said Tender shall be posted on Bank's website only.
 Date: 18-05-2024 Chief Financial Officer

punjab national bank
 Information Technology Division, HO, 5, Sansad Marg, New Delhi-110 001
 (Email ID: eprocurement@pnb.co.in, Phone: 011-23311452)

Tender Notice
 Punjab National Bank invites online bids (both technical and commercial) through GeM Portal (Government e Marketplace) from eligible bidders for RFP for Supply, Implementation, Customization and Management of Robotic Process Automation (RPA) Solution.
 Interested bidders may visit website https://gem.gov.in/ for details.
 Last date for online bid submission is 10.06.2024 at 1600 hrs.
 Chief Manager

Punjab & Sind Bank
 (A Govt. of India Undertaking)
 Head Office: 21, Rajendra Place, New Delhi - 110008
 Corporate Office: NBCC Office Complex, Block 3, East Kirti Nagar, New Delhi - 110023
 https://punjabandsindbank.co.in/

NOTICE
 Extraordinary General Meeting - Election of One Shareholder Director
 List of Valid Candidates

Notice is hereby given in respect of EGM Notice dated 7th May 2024 convening an Extraordinary General Meeting of the Bank for, inter alia, the Election of One Director from amongst Shareholders other than the Central Government, that after scrutiny of nominations and determination of their 'Fit & Proper Status', the nominations of the following candidates have been found to be valid and in order:

Sl. No.	Name & Address	Age (Years)	Educational / Professional Qualifications
1	Shri Suresh Chand Garg, House No B136-A, Gopalpura Bypass, Scheme 10B, Jaipur-302018	58	Chartered Accountant (FCA), M.Com, Insolvency Professional (IBBI)
2	Shri Rajendra Prasad Gupta C-601, Laxmi Bhakti Rahatni Chowk, Pimple Saudagar, Pune - 411017	59	M.Sc (Physics) and Fellow of the Insurance Institute of India, Mumbai

Accordingly, the election of One Shareholder Director will be held at the Extraordinary General Meeting of the Bank scheduled to be held on 31st May 2024 through VC / OAVM and Remote E-voting / e-voting at EGM will be held as per the schedule already announced in the Notice. Shareholders attending the meeting through VC / OAVM, who have not cast their votes through Remote E-voting shall be able to cast their e-votes at the Meeting. Any of the aforesaid candidates desirous of withdrawing his candidature may do so by sending a letter in writing duly signed & addressed to the Company Secretary or sending scanned and signed letter over e-mail at complianceofficer@psb.co.in so as to reach before 5.00 p.m. on 24th May 2024.
 Place: New Delhi
 Date: 18th May 2024
 For Punjab & Sind Bank
 Company Secretary

GRP Limited
 (CIN : L25191GJ1974PLC002555)
 Registered Office: Plot No.8, GIDC Estate, Ankleshwar - 393 002 Dist. Bharuch, Gujarat
 Tel no.: 022 67082600 / 2500, e-mail id: investor.relations@grpweb.com, website: www.grpweb.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED 31st MARCH, 2024 (₹ in Lakhs)

Sr No.	Particulars	Standalone		Consolidated			
		Quarter ended		Quarter ended			
		31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023		
1	Total Income from Operation (Net)	13,872.32	9,538.39	46,161.61	13,794.23	9,554.42	46,137.88
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,786.22	(48.64)	3,353.25	1,775.07	229.14	3,257.73
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,546.65	(48.64)	3,113.68	1,535.50	229.14	3,018.16
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,202.56	(2.17)	2,371.13	1,167.20	275.25	2,263.74
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,194.99	148.75	2,266.13	1,159.63	424.24	2,158.74
6	Equity Share Capital	133.33	133.33	133.33	133.33	133.33	133.33
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	16,685.74	-	-	16,540.47
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) (**Not Annualised)						
	1. Basic : (in ₹)	90.19 *	(0.16)*	177.84	87.54 *	20.64 *	169.78
	2. Diluted : (in ₹)	90.19 *	(0.16)*	177.84	87.54 *	20.64 *	169.78

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly/Year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Year ended Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com & www.bseindia.com) and on the Company's website (www.grpweb.com).
 2. The above results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at its meeting held on 17th May, 2024.
 3. Figures for the previous period are regrouped/reclassified wherever necessary, to make them comparable.

Place : Mumbai
Date : 17th May, 2024

FOR GRP LIMITED
 HARSH R. GANDHI
 JOINT MANAGING DIRECTOR
 DIN 00133091

ઝઘડિયામાં છ દિવસથી વીજ વંચિત ખેડૂતોનો હલ્લો

13મીએ વાવાઝોડાથી નુકસાન થયું હોવાનું કહી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો, ફરી શરૂ કર્યો જ નહીં!

ઝઘડિયા, ગોવાલી, નાનાસાંજ, મુલદ સહિતનાં ગામના ખેડૂતોમાં ભારે રોષ

સિંચાઈના અભાવે ઊભો પાક સુકાઈ રહ્યો છે અને નવું વાવેતર કરી શકાતું નથી, મોટું આર્થિક નુકસાન

ઝઘડિયા: વીજ કંપનીએ ઝઘડિયામાં વાવાઝોડાથી નુકસાનના બહાને છ દિવસથી બંધ કરેલો વીજ પુરવઠો ફરી શરૂ નહીં કરતાં ખેડૂતો ક્રોધી ધલતમાં મુકાયા છે. ઉભા પાકને સિંચાઈના અભાવે નુકસાન થઈ રહ્યું છે, તો સાથે જ નવું વાવેતર થઈ શકતું નથી. વીજ કંપની તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ નહીં મળતાં આજે ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરીએ મોરચો માંડ્યો હતો અને વીજ અધિકારીઓને આરો



વિનોદ વસવા

હાથ લઈ વીજ પુરવઠો તાકીદે શરૂ કરવા માંગ કરી હતી. ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા, ઉચેડિયા, નાનાસાંજ, ગોવાલી, મુલદ, બોરીદરા, ખરચી, સરદારપુરા, ઉટીયા, ગુમાનપુરા, કપલસાડી ફૂલવાડી જેવા ગામોમાં કાયમ કોઈને વાવાઝોડું ગયાને છ દિવસ બાદ પણ ઉચેડિયા, નાનાસાંજ, ગોવાલી તથા મુલદ સહિતના ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો તો ૨૪ કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો. પરંતુ વાવાઝોડું ગયાને છ દિવસ બાદ પણ ઉચેડિયા, નાનાસાંજ, ગોવાલી તથા મુલદ સહિતના ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો પુનઃ ખેડૂતો માટે કાર્યરત કરી આપવામાં ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાયા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. ૪૦ ડિગ્રીથી વધુ ગરમીમાં સિંચાઈ ન મળતા ઉભો પાક મૃત ધલતમાં આવી ગયો છે, કેળના થીયા જમીનદોસ્ત થઈ રહ્યા છે, પાકને

સિંચાઈ ન મળતા પાકનો વિકાસ અટકી પડતા ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે. વીજ પુરવઠાના અભાવે નવું વાવેતર પણ કરી શકાયું નથી. આ બાબતે કસ્ટમર કેર નંબર પર પણ યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂત દ્વારા કરવામાં આવેલો કોલ પણ કોઈ વીજકર્મી ઉપાડતું નહીં હોવાથી રોષે ભરાયેલા ઉચેડિયા, નાનાસાંજ, ગોવાલી તથા મુલદ સહિતના ગામોના ખેડૂતોએ શનિવારના રોજ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આરો હાથે લીધા હતા. ખેડૂતોએ આજની

જ તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી.

ગોવાલી ગામે મંજૂર કરાયેલું નવું સબ સ્ટેશન તાર્કિક શરૂ કરવા સહિતની ખેડૂતોની અનેક માંગ અધૂરી

ખેડૂતોએ વધુ માંગ કરી હતી કે, ગોવાલી ગામ ખાતે નવું સબસ્ટેશન મંજૂર થયું છે, તે પણ ઝડપી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઈનને બે વિભાગમાં વહેંચવામાં આવે. દરેક ગામ દીઠ હેલ્થરો ફિક્સ મૂકવામાં આવે. એગ્રીકલ્ચર લાઈનના દરેક પોલ પર ઝાડી ઝાંખરાની સમયસર સાફ-સફાઈ કરવામાં આવે, તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે, જેથી ચોમાસામાં તથા ભારે પવનમાં વિજપોલ સ્ટ્રક્ચર તથા વિજ લાઈનને નુકસાન થાય નહીં અને કોઈ અકસ્માત ન થાય. ખેડૂતોની આ માંગણીઓ બાબતે ઝઘડિયાના નાયબ ઈન્ચાર્જ દ્વારા ખેડૂતોને હેથાવારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેવું જણાવવાયું હતું.

વીજ સમસ્યાને લઈ ટંકારિયાના લોકોની પાલેજ DGVCL કચેરી ખાતે રજૂઆત

વીજકાપ, હેલ્પર સહિતના વીજપ્રશ્નો અંગે છુટ્ટીની આરંભિક રજૂઆત



ભરૂચ: વીજ સમસ્યાથી પરેશાન થયેલા ટંકારિયાના ગ્રામજનોએ પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ઘોડી જઈ કે. એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના ટંકારિયા ખાતે વીજળીને લગતી કેટલીક સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ DGVCLના કે.એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં આદેશ કર્યો હતો કે, જ્યારે ગામમાં વીજ પુરવઠો મોરચાએ છે ત્યારે તે પહેલા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધાવો તેમ જણાવે છે. જેથી તેમના ગામમાં ફરજ બજાવનાર હેલ્પરની તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ રાત્રે અને દિવસના સમયને અલગ-અલગ હેલ્પર ફાળવવામાં

આવે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તો સમારકામ માટે ફક્ત તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજળી ચાલુ રાખવામાં આવે, ગામનો વીજ પુરવઠાના ભારણનો સરવે કરાવી ડીપી વધારવામાં આવે. પાલેજ, ટંકારિયા તેમજ સીતપોણ ગામની એક લાઈન હોય દરેક ગામોની અલગ-અલગ સ્વીચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારિયા ગામનો વીજ પુરવઠો કાર્યરત રાખવામાં આવે તેવી માંગ કરી હતી. પાલેજ સબ સ્ટેશનથી ટંકારિયા ગામને વીજ પુરવઠાનું

ખેડાણ આપવામાં આવે તો સીધો વીજ પુરવઠો ટંકારિયા ગામને મળી રહે એવી વ્યવસ્થા કરવા પણ માંગ કરી હતી. ટંકારિયા ગામના સામાજિક કાર્યકર સફાવન ભૂતારાએ જણાવ્યું હતું કે, ટંકારિયાના ગ્રામજનો દ્વારા પાલેજ છુટ્ટીની કચેરી ખાતે આવ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી ટંકારિયા ગામને લગતા વીજકાપ, હેલ્પર સહિતના વીજપ્રશ્નો અંગે છુટ્ટીની આધિકારીને રજૂઆત કરતાં તેઓ દ્વારા અમને સંતોષકારક જવાબ મળેલા છે. મુખ્ય અધિકારી પાસે ગ્રામજનોના પ્રશ્નોનું પંદરેક દિવસમાં નિરાકરણ આવે તેવો આશાવાદ છે.

'આ વખતે ખોટો કેસ થશે તો લાખો લોકો સાથે આંદોલન કરીશ': ચૈતર વસાવાની ચીમકી

મનસુખ વસાવા સાથેના વિવાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મોડી રાત્રે Dy.SP. લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરી

ભરૂચ: ધારાસભ્ય ચૈતર વસાવાએ મોડી રાત્રે Dy.SP. લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે, અગાઉ ભાવપના ઈશારે ખોટા પાટા પર ખોટો કેસ કરશે અથવા એકતરફી કાર્યવાહી કરશે તો અમે રોડ પર ઊતરી જઈશું. લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડિયાપાડામાં આંદોલન કરશે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર કેટલી પોસ્ટ ભાવપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઘાટકાંઠા અપાય છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી



અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસમાં જોમોમાં ડરનો માહોલ ફેલાયો છે. એ બાબતની જાણ થતાં હું તાત્કાલિક ડેડિયાપાડામાં પહોંચી રહ્યો છું. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચી કોઈપણ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે. મેનેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાનાં સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. ચૈતર વસાવાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે આદેશ

કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીં કેમ ઘોડી આવો છો. હું ડેડિયાપાડા ટીકીઓ પાસે આચોજનની ફાઈલ લઈને ગયો હતો. ત્યારે તેમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. મેં તેમને ધમકાવ્યા નથી. ટીકીઓને તકલીફ હોય તો એ કેમ ફરિયાદ નથી કરતા, તમે ડેડિયાપાડાનો માહોલ બગાડી અહીં ખોફ ઊભો ના કરશો. આ ઘટના દરમિયાન માહોલ ગરમાયો હતો. આ બાબતે ધારાસભ્ય દ્વારા મદદરાત્રે Dy.SP. લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરવા પહોંચ્યા હતા.



અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામથી વાહનચાલકો અકળાયા

આકરા તાપ તડકામાં લોકોને શેકાવાનો વાદો આવ્યો, પોલીસ યોગ્ય વ્યવસ્થા ગોઠવે એવી માંગ

ભરૂચ: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું

નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દશ્યો જોવા મળ્યા છે. જેમાં સુરતથી વરોદરા તરફ જતાં ટ્રેક પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ, ઉનાળાના આકરા તાપમાં અનેક વાહનચાલકોને

ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ટ્રાફિકજામ થતાં નોકરી ધંધે જતાં લોકો પણ અટવાયા હતા. પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં લેવામાં આવે તો દરરોજ ઉદભવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.



જંબુસર-પાદરા રોડના ખાડાનાં GPS લોકેશન સાથે મુખ્યમંત્રીને ફરિયાદ!

વાહનોથી સતત ધમધમતો આ રોડ બિસ્માર થતાં વાહનચાલકોની ભીતિ વધી

ભરૂચ: વાહનોથી સતત ધમધમતા જંબુસર-પાદરા રોડ બિસ્માર ધલતમાં હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોની ભીતિ પણ વધી છે. ત્યારે આ રોડની મરામત કરવામાં આવે એવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે. જંબુસર-પાદરા રોડ વાહન વ્યવહારથી ધમધમતો રોડ છે અને આ રોડ પરથી સોરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે. જો કે આ રોડ કેટલાય સમયથી બિસ્માર છે. તેના પર મોટા ખાડી પડી ગયા છે. ખાડાઓને લઈને આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે. પરંતુ તંત્ર નિંદ્રાધિન હોય તેમ થયા બાદ આ ઓવરબ્રિજ ઉપર તેમજ અર્પણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.



કાને જનતાનો અવાજ પહોંચતો નથી તેવું જણાઈ રહ્યું છે. આ મામલે જંબુસર ટ્રક ઓનર એસોસિએશનને પણ જંબુસર તરફ પાદરા ધારાસભ્યને પણ રજૂઆતો કરી હતી. ધલતમાં જ આ રોડની ફોરલેનની કામગીરી કાર્યરત છે, પરંતુ જૂના રોડ પર પણ ખાડાઓ પૂરવામાં આવે અને ઉભડખાબડ રોડને સમતળ કરવામાં આવે તેવી માંગ સાથે જંબુસર એસોસિએશનના રોમેશભાઈ શાહ, કિરણકુમાર પટેલ વિગેરેએ, ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા સાથે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદ કરી છે.

માંગરોળના બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી

વાંકલ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં બુટલેગર સુમિત ગામીત સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી રાજકોટ મથકથી જેલભેગો કરવામાં આવ્યો હતો.

માંગરોળના બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી

કોસંબા રેલવે ઓવરબ્રિજની કામગીરીને આખરે વેગ મળ્યો

તંત્રએ આગામી ખંખેરીને કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે મશીનરી કામે લગાડી

લાંબો ચક્રાવો લેવો પડતો હોવાથી ઓવરબ્રિજના ઉદ્ઘાટનની રાહ જોયા વિના ઓવરબ્રિજ ઉપરથી વાહનો શરૂ કરી દીધાં હતાં. જે બાબતનો અહેવાલ ગુજરાતમિત્ર અખબારમાં પ્રસિદ્ધ થતાં તદ્દન કાચબા ગતિએ ત્રણ વર્ષથી ચાલી રહેલી કામગીરીમાં હરકતમાં આવેલા અગામી ખંખેરીને કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે મશીનરી કામે લગાડી દઈ કામગીરી ગતિ તેજ બનાવી દઈ ઓવરબ્રિજ ઉપર તેમજ ઓવરબ્રિજની નીચે સર્કલ રોડ પર પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેતાં હાલ દ્રૂક સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ ઓવરબ્રિજ પ્રજા માટે અર્પણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

Milano MULTIPLEX બારડોલી Samandar (Gujrati) 11:00pm, 02:00pm, 06:00pm, 09:00pm Kingdom Of Planets Of The Apes (Hindi) 12:30pm, 03:30pm, 06:30pm, 09:30pm Shrikanth: 10:00 am, 01:00pm, 04:00pm, 07:00pm, 10:00pm Ph: 02622-230068 "Movie schedule and timings are subject to change without any prior notice" સંપર્ક: 98791 33333

ગુજારતી લિમિટેડ (CIN : L25191GJ1974PLC002555) રવિવેડ ઓફિસ: પોલ નં. 8, GIDC એસ્ટેટ, અંકલેશ્વર - 393 002 જિ. ભરૂચ, ગુજરાત ટેલ નં. 22 67082600 / 2500, ઈમેલ આઈડી: investor.relations@grpweb.com, વેબસાઈટ: www.grpweb.com 31 માર્ચ-2024ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટર અને વાર્ષિક માટે અનઓડિટ નાણાકીય પરિણામોનો સાર (રૂ. લાખમાં)

ક્રમ નંબર	વિગતો	એવ		ઓડિટ	
		ક્વાર્ટર સમાપ્ત થયેલ	વાર્ષિક સમાપ્ત થયેલ	ક્વાર્ટર સમાપ્ત થયેલ	વાર્ષિક સમાપ્ત થયેલ
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
		ઓડિટડ	ઓડિટડ	ઓડિટડ	ઓડિટડ
1	કામગીરીમાંથી કુલ આવક	13,872.32	9,538.39	46,161.61	13,794.23
2	સમઘણા માટે ચોખ્ખો નફો (નુકસાન) (કર પહેલા, અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	1,786.22	(48.64)	3,353.25	1,775.07
3	કર પહેલાના સમઘણા માટે ચોખ્ખો નફો (નુકસાન) (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	1,546.65	(48.64)	3,113.68	1,535.50
4	કર પછીના સમઘણા માટે ચોખ્ખો નફો (નુકસાન) (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	1,202.56	(2.17)	2,371.13	1,167.20
5	સમઘણા માટે કુલ વ્યાજ આવક (સમાવિષ્ટ નફો) (નુકસાન) સમઘણા માટે (કર પછી) અને અન્ય વ્યાજ આવક (કર પછી)	1,194.99	148.75	2,266.13	1,159.63
6	ઈન્ડિવિડ્યુઅલ મૂલ્યો	133.33	133.33	133.33	133.33
7	અન્ય ઈન્ડિવિડ્યુઅલ (પુનઃમૂલ્યાંકન અનામત સિવાય) પાછલા વર્ષની ઓડિટડ બેલેન્સ શીટમાં દર્શાવ્યા મુજબ	-	-	16,685.74	-
8	રોડ દીઠ કમ્પાઉન્ડ (દરેક રૂ. 10/-) (સાચુ બંધ બંધાવવા માટે) ("વાર્ષિક નથી")	90.19	(0.16)	177.84	87.54
1.	બેલેન્સ (રૂ.માં)	90.19	(0.16)	177.84	87.54
2.	કાલકલ્પક (રૂ. માં)	90.19	(0.16)	177.84	87.54

નોંધો: 1. ઉપરોક્ત સાર (લિસ્ટિંગ, એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર કોન્ટ્રોલ સિસ્ટમ) 2015ના નિયમ 33 હેઠળ સીલ એક્ટરનેશનમાં ફાલ હયાતમાં આવેલા ક્વાર્ટર/વાર્ષિક સમાપ્ત થયેલા નાણાકીય પરિણામોના વિગતવાર રોડેટનો સાર છે. 2. સીલ એક્ટરનેશનની વેબસાઈટ (www.nseindia.com) અને ડાઉનલીડ વેબસાઈટ (www.grpweb.com) પર વર્ષના સમાપ્ત થયેલા નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ડેટેલ પ્રિન્ટ આપવામાં આવેલું છે. 3. અગાઉના સમઘણા માટેના ઓડિટમાં જ્યાં પણ જરૂરી હતું ત્યાં ત્રિપુલ-રોડલાઈટફાઈલ કરવા છે જેથી તે સરખામણી કરવા લાયક બને. ફોર સુધારણી લિમિટેડ હવે આર. ગાંધી પોર્ટલ એન્જિનિયરિંગ કોર્પોરેશન ડિવિઝન દ્વારા ડિજિટાઇઝેશન કરવામાં આવેલું છે. 31 માર્ચ-2024ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટર અને વાર્ષિક માટે અનઓડિટ નાણાકીય પરિણામોનો સાર (રૂ. લાખમાં)